

# ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી

:: સુધારા યાદી ::

વંચાણે લીધી:(1) આયોગની તા.30.03.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.

(2) આયોગની તા.03.05.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની બીજી યાદી.

(3) આયોગની તા.20.05.2017ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી

1. સરકારી પોલીટેકનીક ખાતે રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા, ગુ.શિ.સેવા, વર્ગ-2 (કોલેજ શાખા) (જા.ક. 81/2015-16) (ખાસ ભરતી) સંદર્ભમાં આયોગ દ્વારા તા.23.10.2016 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર થતા કુલ: 21 ઉમેદવારોની યાદી તા.20.05.2017ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

2. પાત્રતા ચકાસણી પત્રક (હા/ના) મુજબ અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગના બેઠક નં.101000253 પરના અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગના ઉમેદવારે અરજી પત્રક સાથે જરૂરી પ્રમાણપત્રો રજૂ કરેલ ન હોય, ઉમેદવારી રદ કરવામાં આવેલ હતી. આથી આ ઉમેદવારનો અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગ માટે આયોગે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવતા હોવા છતાં રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ ન હતો.

3. રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી અન્વયે વિચારણા હેઠળના આ ઉમેદવારે આ જાહેરાતના અનુસંધાને તેમણે કરેલ ઓન-લાઇન અરજીની પ્રિન્ટેડ નકલ, જરૂરી દસ્તાવેજો સાથે આયોગની કચેરીમાં જમા કરાવ્યાના આધાર/પુરાવા રજૂ કરતાં રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવાનો સંબંધિત ભરતી શાખાની ફાઇલ પર નિર્ણય થયેલ છે.

4. પ્રસ્તુત જાહેરાત સંબંધે હવે અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગના ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ અનુસાર નક્કી કરવાની થાય, આથી આ જાહેરાતમાં જણાવેલ અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગના ઉમેદવારોની કુલ 02 અનામત જગ્યાઓ માટે નોર્મ્સ મુજબ કુલ: 08 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવાના થતા હતા, પરંતુ સરખા ગુણને કારણે વધુ 01 ઉમેદવાર મળી કુલ: 09 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.

5. અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગની મેરીટ યાદી ધ્યાને લેતાં છેલ્લા 02 ઉમેદવારો (1) બેઠક નં.101000065 અને (2) બેઠક નં.10100099 પરના ઉમેદવારો સરખા ગુણ ધરાવે છે, હવે બેઠક નં.101000253 પરના ઉમેદવારનો આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા હોવાથી રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરવાનો થાય,

# 2 #

આમ થતાં અનુ.જનજાતિ (પુરૂષ) વર્ગના ઉમેદવારોની મેરીટ યાદીના છેલ્લા 02 ઉમેદવારો (1) બેઠક નં.101000065 અને (2) બેઠક નં.101000099 નો રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી હેઠળની નોંધ “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે પરંતુ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માં સમાવેશ કરી રૂબરૂ મુલાકાત માટે અપાત્ર જાહેર કરવામાં આવે છે. તથા બેઠક નં.101000253 પરના ઉમેદવારને રૂબરૂ મુલાકાતને પાત્ર જાહેર કરવામાં આવે છે.

6. આમ થતાં રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની કુલ સંખ્યા 20 થશે જ્યારે રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી હેઠળની નોંધ: (1) ના ઉમેદવારોની કુલ સંખ્યા 05 થશે, તથા યાદી હેઠળની નોંધ: (2) આમેજ કરી “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માં (1) બેઠક નં.101000065 અને (2) બેઠક નં.101000099 નો સમાવેશ કરવામાં આવે છે, આયોગની કચેરી દ્વારા તા.20.05.2017ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

S/d

સ્થળ: ગાંધીનગર-382010

તારીખ: 15.07.2017

સંયુક્ત સચિવ

ગુજરાત જાહેર સેવા આયોગ